

Seat No: \_\_\_\_\_

No. Of Printed Page: 03

[13/14]

**SARDAR PATEL UNNIVERSITY**

E

**B.COM SEM-1****PAPE4R CODE : UBIODCOM51/21****SUBJECT : Advanced Accounting.1****Date: 13/06/2022****Total Marks.60****Day: Monday****Time: 09:00 To 11:00 A.M.****Instructions: (1) All questions carries equal marks.****(2) Answer any four from the following.**

- Q-1. Shri Rajiv Purchased a Machine from Sanjiv & Company on 1/4/2017 on hire purchase system. Rs.10,000 was paid as signing amount. The balance amount is payable in four annual instalments at 10% interest as follows: (15)

Date	Instalments(Rs.)
31/3/2018	10,900
31/3/2019	9,100
31/3/2020	7,400
31/3/2021	8,800

Find out cash price of the machine and prepare machine account.

- Q-2. Explain difference between Hire Purchase System and Instalment system. (15)
- Q-3. Binaca Radio Consigned 1000 radio to Cibaca Radio Service on 1/3/2021. The cost price was Rs.600 per radio, but the pro forma invoice was made out at a figure so as to show a profit of 25% on invoice price. On the same day, Binaca Radio incurred the following expenses. (15)

	Rs.
Carriage.	2,000
Freight	30,000
Insurance	25,000

On the same day Cibaca Radio Service sent a draft for Rs.2,44,000. On 30<sup>th</sup> June 2021 Cibaca Radio Service Sent an Account Sale and bank draft for the amount payable. According to account Sale 600 Radios were sold at Rs.820 each for cash, 100 Radios were sold at Rs.850 each to Anil on credit and 40 Radios were sold at Rs.840 each to Sunil on the recommendation and responsibility of Binaca Radio. Selling expenses incurred Rs.10,450 Octroi incurred Rs.7000, Anil and Sunil became bankrupt and Cibaca radio could recover only 80% from their estate. Cibaca radio service is entitled to get a commission of 5% on sale and 2% del-credere commission of credit sales.

Prepare necessary Accounts in the books of consignor.

(P.T.O.)

- Q-4. (A) Write Short Note on: General Commission and Del-Credere Commission. (08)  
(B) Explain difference between Consignment and Sale. (07)

- Q-5. Explain difference between Consignment and Joint Venture. (15)

- Q-6. On 1<sup>st</sup> October, 2020 Jay and Vijay entered in to joint venture sharing profit and losses in the ratio 2:1. They deposited Rs.1,00,000 and Rs.50,000 respectively in to their Joint Bank Account and decided that Joint Bank Account is to be used for purchase and sale, While joint venture expenses should be paid by each partners out of their private funds. Jay is to be paid annual salary of Rs.10,000 for general administration and Vijay is to be paid commission at 10% on sales he affects. (15)  
Jay purchased goods worth Rs.1,00,000 and paid for expenses Rs.5000. Vijay sold some of the goods for Rs.1,00,000 and paid selling expenses Rs.2000. Unsold goods worth Rs.34,000 were taken over by Jay.

Accounts were settled on 31<sup>st</sup> March 2021.

Prepare Joint Venture Account, Accounts of the co-venturers and Joint Bank Account.

- Q-7. Explain meaning, Salient features and Limitations of single entry system. (15)
- Q-8. Shri Bharatbhai shah maintained his account on single Entry System. From the following details prepare profit and loss Account for the year ending 31<sup>st</sup> March, 2021 and Balance Sheet as on the date: (15)

**(1) Following were the balances on 1/4/2020.**

	Rs.		Rs.
Creditors	5,500	Furniture	900
Debtors	7,000	Stock	4,500
Bill receivables	1,700	Cash balance	1,200
Bill payables	800		

**(2) The Transactions during the year were as under:**

	Rs.		Rs.
Cash Paid for Bills Payables	3,000	Cash Received for Bills Receivables	3,000
Received from Debtors	3,600	Paid to creditors	2,400
Discount allowed	1,500	Discount received	600
Sundry expenses Purchase of	8,800	Bad debt	500
Furniture (1-10-2020)	600	Purchase returns	400
		Sales returns	800
		Drawings	2,000

**(3) Following were the balances as on 31/4/2021.**

	Rs.		Rs.
Debtors	9,000	Bills payable	2,900
Creditors	3,600	Cash balance	1,800
Bills receivables	1,400	Closing Stock	6,000

**(4) Adjustments:**

- (1) Provide interest on Capital at 10%
  - (2) Provide for Reserve for bad and doubtful Debts at 5% on Debtors
  - (3) Provide for depreciation on Furniture at 10% per annum.
-



Seat No. \_\_\_\_\_

No. of print pages 02

[13]14] ન

**SARDAR PATEL UNIVERSITY**

B.COM SEM - I

PAPER CODE: UB01DCOM51

SUBJECT : Advanced Accounting - I

Date : 13/06/2022

Total Marks : 60

Day : MondayTime : 09:00 to 12:00 P.M.

સૂચના : (૧) દરેક પ્રશ્નના ગુણ સરખા છે.

(૨) નીચેનામાંથી ગમે તે ચાર પ્રશ્નોના જવાબ આપો.

પ્રશ્ન-૧. શ્રી રાજીવ મેસર્સ સંજીવ એન્ડ કંપનીમાંથી તા.૧/૪/૨૦૧૭ ના રોજ એક ચંત્ર ભાડા ખરીદ પદ્ધતિથી (૧૫)  
ખરીદ્યું. કરાર વખતે તેણે રૂ.૧૦,૦૦૦ ચુકવ્યા અને બાકીની રકમ ચાર વાર્ષિક હપ્તાઓમાં ૧૦% ના વ્યાજ  
સહિત નીચે મુજબ ચુકવવાની છે.

તારીખ	હપ્તા (રૂ.)
૩૧/૩/૨૦૧૮	૧૦,૬૦૦
૩૧/૩/૨૦૧૯	૯,૧૦૦
૩૧/૩/૨૦૨૦	૭,૪૦૦
૩૧/૩/૨૦૨૧	૮,૮૦૦

રોકડ કિંમત શોધો અને ફક્ત ચંત્ર ખાતું તૈયાર કરો.

પ્રશ્ન-૨. ભાડા ખરીદ પદ્ધતિ તથા હપ્તા પદ્ધતિ વચ્ચેનો તફાવત સમજાવો. (૧૫)

પ્રશ્ન-૩. બિનાકા રેડિયોએ ૧,૦૦૦ રેડિયા, સિબાકા રેડિયો સર્વિસને તા.૧/૩/૨૦૨૧ના રોજ આડતથી વેચવા માટે (૧૫)  
મોકલ્યા. દરેક રેડિયાની મૂળ કિંમત રૂ.૬૦૦ છે, ભરતિયા કિંમત પર ૨૫% નફો મળે તે રીતે ભરતિયા  
કિંમત નક્કી કરવામાં આવી હતી. એજ દિવસે બિનાકા રેડિયોએ નીચેના ખર્ચા કર્યા.

	રૂ.
ગાડીભાડું	૨,૦૦૦
નૂર	૩૦,૦૦૦
વીમો	૨૫,૦૦૦

એજ દિવસે સિબાકા રેડિયો સર્વિસે રૂ.૨,૪૪,૦૦૦નો બેંક ડ્રાફ્ટ મોકલ્યો તા.૩૦મી જૂન ૨૦૨૧ ના રોજ  
સિબાકા રેડિયો સર્વિસે વેચાણ આંકડા સાથે બેંક ડ્રાફ્ટ મોકલ્યો. વેચાણ આંકડા મુજબ ૬૦૦ રેડિયા દરેક  
રૂ.૮૨૦ની કિંમતે રોકડેથી વેચ્યા. ૧૦૦ રેડિયા દરેક રૂ.૮૫૦ ની કિંમતે અનિલને ઉધાર વેચ્યા. બિનાકા  
રેડિયોની ભલામણ અને જવાબદારીથી ૪૦ રેડિયો દરેક રૂ.૮૪૦ની કિંમતે સુનિલને વેચ્યા. વેચાણ ખર્ચા  
રૂ.૧૦,૪૫૦ અને ઓકટ્રોય રૂ.૭,૦૦૦ થઈ.

અનિલ અને સુનિલ નાદાર થયા તેમની મિલકતમાંથી ૮૦% રકમ સિબાકા રેડિયો સર્વિસને મેળવી.  
સિબાકા રેડિયો સર્વિસને વેચાણ પર ૫% કમિશન અને ઉધાર વેચાણ પર ૨% કમિશન આપવાનું છે.

માલધણીના ચોપડે જરૂરી ખાતાઓ તૈયાર કરો.

- પ્રશ્ન-૪. (અ) ટૂંકનોંધ લખો સામાન્ય આડત અને અસામી આડત (૦૮)  
 (બ) આડતમાલ અને વેચાણ વચ્ચેનો તફાવત સમજાવો. (૦૭)
- પ્રશ્ન-૫. આડતમાલ અને રાશ વચ્ચેનો તફાવત સમજાવો. (૧૫)
- પ્રશ્ન-૬. તા.૧/૧૦/૨૦૨૦ ના રોજ જય અને વિજય રૂ.૧ ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચવાની શરતે રાશના (૧૫)  
 ધંધામાં જોડાયા. તેમણે સંયુક્ત બેંક ખાતામાં અનુક્રમે રૂ.૧,૦૦,૦૦૦ અને રૂ.૫૦,૦૦૦ જમા કરાવ્યા અને  
 ઠરાવ્યું કે સંયુક્ત બેંક ખાતાનો ઉપયોગ ખરીદ અને વેચાણ માટે કરવો. જ્યારે રાશના ખર્ચા દરેક  
 ભાગીદાર અંગત રોકડમાંથી ચુકવવાના છે. જયને સામાન્ય વહીવટ માટે વાર્ષિક રૂ.૧૦,૦૦૦ લેખે પગાર  
 આપવાનો છે અને વિજયને તેણે કરેલા વેચાણ પર ૧૦% કમિશન આપવાનું છે. જયે રૂ.૧,૦૦,૦૦૦ નો  
 માલ ખરીદ્યો. અને ખર્ચના રૂ.૫,૦૦૦ ચૂકવ્યા. વિજયે કેટલોક માલ રૂ.૧,૦૦,૦૦૦ માં વેચ્યો અને વેચાણ  
 ખર્ચના રૂ.૨,૦૦૦ ચૂકવ્યા. રૂ.૩૪,૦૦૦ની કિંમતનો નહિ વેચાયેલો માલ જયે રાખી લીધો.  
 તા.૩૧મી માર્ચ, ૨૦૨૧ ના રોજ હિસાબની પતાવટ કરવામાં આવી.  
 રાશ ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને સંયુક્ત બેંક ખાતું તૈયાર કરો.
- પ્રશ્ન-૭. એકનોંધી હિસાબી પદ્ધતિનો અર્થ સમજાવો. તેના મુખ્ય લક્ષણો અને મર્યાદાઓની ચર્ચા કરો. (૧૫)
- પ્રશ્ન-૮. શ્રી ભરતભાઈ શાહ પોતાના હિસાબો એકનોંધી હિસાબી પદ્ધતિથી રાખે છે. નીચેની વિગતો પરથી (૧૫)  
 ૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ પૂર થતા વર્ષ માટેનું નફા-નુકશાન ખાતુ અને તે તારીખનું પાકું સરવૈયું તૈયાર  
 કરો.
- (૧) તા.૧/૪/૨૦૨૦ ના રોજની બાકીઓ:
- |            |       |           |       |
|------------|-------|-----------|-------|
|            | રૂ.   |           | રૂ.   |
| લેણદારો    | ૫,૫૦૦ | ફર્નિચર   | ૮૦૦   |
| દેવાદારો   | ૭,૦૦૦ | સ્ટોક     | ૪,૫૦૦ |
| લેણીહૂંડી  | ૧,૭૦૦ | રોકડ સિલક | ૧,૨૦૦ |
| દેવી હૂંડી | ૮૦૦   |           |       |
- (૨) વર્ષ દરમિયાનના વ્યવહારો:
- |                       |        |                    |        |
|-----------------------|--------|--------------------|--------|
|                       | રૂ.    |                    | રૂ.    |
| દેવી હૂંડીના ચુકવ્યા  | ૩,૦૦૦  | લેણી હૂંડીના મળ્યા | ૩,૦૦૦  |
| દેવાદારો પાસેથી મળ્યા | ૩૬,૦૦૦ | લેણદારોએ ચૂકવ્યા   | ૨૪,૦૦૦ |
| વટાવ આપ્યો            | ૧,૫૦૦  | વટાવ મળ્યો         | ૬૦૦    |
| પરચુરણ ખર્ચા          | ૮,૮૦૦  | ઘાલખાધ             | ૫૦૦    |
| ફર્નિચરની ખરીદી       |        | વેચાણ માલ પરત      | ૮૦૦    |
| (તા.૧/૧૦/૨૦૨૦)        | ૬૦૦    | ઉપાડ               | ૨,૦૦૦  |
- (૩) તા.૩૧/૩/૨૦૨૧ના રોજની બાકીઓ:
- |           |       |            |       |
|-----------|-------|------------|-------|
|           | રૂ.   |            | રૂ.   |
| દેવાદારો  | ૯,૦૦૦ | દેવી હૂંડી | ૨,૮૦૦ |
| લેણદારો   | ૩,૬૦૦ | રોકડ સિલક  | ૧,૮૦૦ |
| લેણીહૂંડી | ૧,૪૦૦ | આખર સ્ટોક  | ૬,૦૦૦ |
- (૪) હવાલાઓ:
- (૧) મૂડી પર વાર્ષિક ૧૦% વ્યાજ ગણો.  
 (૨) દેવાદારો પર ઘાલખાધ અનામત ૫% રાખો.  
 (૩) ફર્નિચર પર વાર્ષિક ૧૦% લેખે ઘસારો ગણો.